

**PUBLIC NOTICE**  
My Clients Hemant Mahendrakumar Jain Etc. have Demanded Title Clearance Certificate for the Block No. A/56 of Amar Park Situated at Dist. Sub. Dist. Vadodara R.S. Nos. 1214/1 and 1215 of Moje Harni, The Lodgement Receipt of The Sale Deed No. 2157, Dated - 28-06-1994 is missing. If any Individual or Financial Institution have any objection against issuance of title clearance certificate, please send written objections with Documentary Evidence within 07 days of publication of this notice, if any objection may not received within stipulated time, the Title Clearance certificate will be issued. Date: 29-05-2023, Vadodara.

413, Navrang Complex, Hotel Utshav Compound, Ravpura, Vadodara. Mo.9879524134

**ASHISH H. SHAH**  
(ADVOCATE)

**बैंक ऑफ इंडिया Bank of India BOI**  
**IMPORTANT NOTICE OF BRANCH PREMISE SHIFTING**  
Our Bank of India Navsari Branch (2901) is SHIFTING FROM TODAY i.e. 29.05.2023 to New Location at following address :  
The Proposed Address :  
**Bank of India Navsari Branch**  
BSNL Building, Ground Floor,  
Before Sandhkuva Police Station, Dist. Navsari-396445  
Date : 29.05.2023 Branch Manager, Navsari Branch.

**pnb Housing Finance Limited**  
Ghar Ki Baat  
Regd. Office: 9th Floor Antriksh Bhawan, 22, K. G. Marg, New Delhi-110001  
Ph: 011-23445200, Website: www.pnbhousing.com CIN : L65922DL1988PLC033856

**NOTICE FOR CLOSURE OF BRANCH OFFICE**  
This is to notify to the General Public that the branch office of PNB Housing Finance Limited located at Office No.104, First Floor, Shree Mangalam Complex, Old Amber Cinema, Kanakia Plot, Jethpur - 360370, Gujarat cease to be operational effective 31st August 2023 to achieve operational efficiency.  
The customer including deposit holders or loan customers of the above branch shall be serviced across all branches including through nearest branch i.e. Rajkot in future located at:  
**PNB HOUSING FINANCE LIMITED**  
Office No. 101, Business Park-1, Opp. Ratnam Hospital, Opp. Eagle Travels, Moti Tanki Chowk, Rajkot-360001, Gujrat  
The details of all the Branches can be viewed at our website www.pnbhousing.com. For any further assistance : Toll Free No. 18001208800 email: customercare@pnbhousing.com  
Sd/-, Authorised Officer, PNB HOUSING FINANCE LIMITED

**Public Notice**  
I/We, RAGHUVIR VISHNUPANT MARATHE holders of 450/- equity shares of face value of Rs. 2 in J.B. Chemicals & Pharmaceuticals Ltd. (the company) have lost/misplaced certificate for the said 450 equity shares as per details given hereunder.

Folio No.	Certificate No.	Distinctive No.
0050690	000000658	0000826411- 0000826860

The members of public are hereby informed that we have made an application to the company for issue of the duplicate share certificate. Any person who has objection or has any adverse claim may intimate the company with valid documents within 30 days from the date of publication of this notice at its registered office at Neelam Centre, "B" Wing, 4th floor, Hind Cycle Road, Worli, Mumbai 400 030. The company will proceed to issue duplicate certificate for the above referred equity shares if no valid objection is lodged with the company within the aforesaid period.  
Name : RAGHUVIR VISHNUPANT MARATHE  
Address: SUYOG, Anandpura, B/H. Govt Press, Raopura, VADODARA - 390001  
Date: 29/05/2023

**APPENDIX - IV (Rule-8(1)) POSSESSION NOTICE (Symbolic) (for immovable property)**

**BARODA BRANCH**  
Whereas, The undersigned being the Authorized officer of the Indian Bank, Baroda Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under section 13 (2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a demand notice dated: 11/10/2019 calling upon the borrower Mrs. Shafikabanu M Shaikh (Borrower cum Mortgagor) and Mr. Hajimohmadsafi Abdul Rehman Shaikh (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 75,14,626 (Rupees Seventy five lac fourteen thousand six hundred twenty six only) with interest as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the security enforcement rules 2002 on this 24<sup>th</sup> day of May of the year 2023. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank for an amount of Rs. 75,14,626 (Rupees Seventy five lac fourteen thousand six hundred twenty six only) and interest thereon  
The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**  
Details of Mortgaged Property  
Vacant residential Flat situated at Flat No. B 807, R.S No. 438, F.P No. 152, T.P Scheme No. 22 8<sup>th</sup> floor, B-Wing, White House, Tandajla Vadodara measuring 6345 sqr. Bounded as: East : Way of Binanagar Society, West: Shobhanagar, North: Tower -A, South: Compound.  
Place : Vadodara, Date : 24-05-2023 Authorised Officer, Indian Bank

**APPENDIX - IV (Rule-8(1)) POSSESSION NOTICE (Symbolic) (for immovable property)**  
(Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas, The undersigned being the authorized officer of Indian Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14/03/2023 calling upon Mr. Shailesh Chandul Marwadi (Borrower And Mortgagor) to repay the amount mentioned in the notice being to Rs. 20,89,254/- (Rupees Twenty Lakhs Eighty Nine Thousand Two Hundred and Fifty Four Only) as on 13/03/2023 + further interest and other expenses within 60 days from the date of receipt of the said notice.  
The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 23rd day of May of the year Two Thousand Twenty Three.  
The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, SURAT for an amount of Rs. 21,00,563/- (Rupees Twenty One Lakhs Five Hundred and Sixty Three only) as on 22/05/2023 + further interest and other expenses thereon.  
The borrower's attention is invited to the provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**  
Flat No. D-504, 5th Floor, Sai Poojan Residency, situated at Pisdad, land bearing Survey No. 6/2, Block No. 8, T.P Scheme No. 45 (Jahangirpura-Pisdad), Final Plot No. 12, measuring 15596.00 sq mtrs. Paikae Part-A, B, C, D Paikae Part B measuring 3010.00 sq. mtrs of Village Pisdad, Taluka- Adajan, (Surat City), District Surat; Flat Built Up area measuring 710.27 sq. fts i.e. 66.01 sq. mtrs + along with undivided proportionate share measuring 18.15 sq mtrs in common road and COP Land, as given hereunder in Schedule 'A'. The boundaries of the Property as per sale agreement are : North by: Open to sky space, South by: Adj. Flat No. D-503, East by: Adj. Flat No. D-501, West by: Open to sky space  
Place : Surat Date : 23/05/2023 Authorised Officer, Indian Bank Surat Main Branch

**PUBLIC NOTICE**  
TAKE NOTICE THAT Firoz H. Pathan have agreed to mortgage to my/our client -IDFC FIRST BANK Limited, (Branch Address A-101, 102 on First Floor, Sahyog Atrium, OP Road, Vadodara) the property more particularly described in the schedule mentioned hereunder written (hereinafter referred to as "the said property") free from all charges or encumbrances.  
That our Client Firoz H. Pathan has demanded for the title clearance certificate for the property situated at non-agricultural land in Mauje: Tandajla, Vadodara lying being land bearing Survey No. 77, 78 & 80, T.P. Scheme No. 21, F.P. No. 68, measuring 6079.00 Sq. Mtrs., Known as "TAIFNAGAR", Shop No. G/129 on Ground Floor, Construction area measuring 269.00 Sq. Fts., at Registration District & Sub-District Vadodara District Vadodara. That the above captioned property was previously owned by Jubedaben Akbar Gayakwad Vides Registration No. 345 dated 16.01.2004, thereby Jubedaben Akbar Gayakwad was died on 25.09.2010 & his husband Akbarbhai Rasulbhai Gayakwad was died on 02.12.2000. Thus virtue of their legal heirs 1. Aiyub Akbar Gayakwad 2. Bilkish Akbar Gayakwad 3. Saibhai Akbar Gayakwad by became the joint owners in the year 2021 & thereafter Saibhai Akbar Gayakwad was died on 07.09.2021 and thereby Virtue of Succession his legal heirs 1. Jubeda Wifio Said Gayakwad 2. Afsana Said Gayakwad 3. Romana Said Gayakwad 4. Rohan Said Gayakwad. They also became joint owner of the Captioned property. Thus, 1. Aiyub Akbar Gayakwad 2. Bilkish Akbar Gayakwad 3. Jubeda Wifio Said Gayakwad 4. Afsana Said Gayakwad 5. Romana Said Gayakwad 6. Rohan Said Gayakwad becomes the joint Owners of the Captioned Property. Thus therefore if any individual, Bank or any Financial Institution has its charge or lien on the said property then within 7 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If no send within given period then my client will initiate further proceedings.  
Description of Property  
All that Piece and Parcel of Non-Agriculture of land in Mauje: Tandajla, Vadodara lying being land bearing Survey No. 77, 78 & 80, T.P. Scheme No. 21, F.P. No. 68, measuring 6079.00 Sq. Mtrs., Known as "TAIFNAGAR", Shop No. G/129 on Ground Floor, Construction area measuring 269.00 Sq. Fts., at Registration District & Sub-District Vadodara District Vadodara & bounded as under: East : By Shop No. G/128 West : By Shop No. G/130 North : By Society House after Margin South : By Road Dt. 28.05.2023 Vadodara Under the instruction from the client

**LE-EXPERT ASSOCIATES**  
KHUSHBU ASHOKKUMAR MISHRA (ADVOCATE)  
MAYURKUMAR DINESHCHANDRA VYAS (ADVOCATE)  
3F, 15-16, Darshanam Trade Center-1, Beside Darshanam Central Park, Near Hotel Surya Palace, Sayajiganj, Vadodara. (M) 7874538288

**APPENDIX-IV [Rule-8(1)] Possession Notice (For Immovable Property)**

**RAJMAHAL ROAD BRANCH**  
Whereas, The Authorized officer of the Indian Bank, Rajmehal Road Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under section 13 (2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a demand notice dated 27.12.2022 calling upon the Mr. Prakash Achal Singh Marwadi (Borrower cum Mortgagor) and Mr. Umesh Nayanbhai Khavra (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 12,98,756.77 (Rupees Twelve lac Ninety eight thousand seven hundred fifty six and ps seventy seven Only) with interest as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice.  
The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 25<sup>th</sup> May, 2023.  
The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Indian Bank for an amount of Rs. 12,98,756.77 (Rupees Twelve lac Ninety Eight Thousand Seven Hundred Fifty Six and Ps Seventy Seven Only) and interest thereon  
The borrower's attention is invited to sub-section (8) of Section 13 in respect of time available to redeem the secured assets.

**Description of the Immovable Property**  
Details of Mortgaged Property  
"The Land and Building bearing Flat No. C203, 2<sup>nd</sup> Floor, Krupa Residency, Near National Highway NO. 8 behind Shreeji High view, Sayajipura, Vadodara, 390019, Plot/Survey No. 588/b, T.P.S No. 02 measuring 75.25 square meters standing in the name of Mr. Prakash A Marwadi Bounded as : East : After Passage, Flat No. C-204, West : Plot No. 13, North : Tower - D, South : Flat No. C-202.  
Place : Vadodara, Date : 25-05-2023 Authorised Officer, Indian Bank

**DEEP INDUSTRIES LIMITED**  
CIN: L14292GJ2006PLC049371 REGI. OFFICE : 12A & 14, ABHISHREE CORPORATE PARK, AMBLI BOPAL ROAD, AMBLI, AHMEDABAD - 380058  
Ph.: 02717-298510 Fax: 02717-298520, E-mail: cs@deepindustries.com website: www.deepindustries.com

**STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31<sup>st</sup> MARCH, 2023** (Rs. In Lakhs)

Sr No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended		Year ended		Quarter ended		Quarter ended		Year ended		Quarter ended	
		31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022	31.03.2022	31.03.2022
1	Total Income from Operations (net)	9,416.19	9,464.38	7,905.04	32,159.59	28,193.06	10,861.57	10,001.73	8,594.10	35,258.54	32,626.67		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,107.39	3,003.71	2,387.39	10,456.11	8,737.00	3,532.66	3,267.15	2,330.82	10,696.52	9,070.23		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,107.39	3,003.71	2,387.39	10,456.11	8,737.00	3,532.66	3,267.15	2,330.82	10,696.52	9,070.23		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,335.98	2,229.86	1,770.35	7,830.84	6,934.14	7,225.91	2,493.30	1,717.68	12,529.92	7,239.81		
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) & Other Comprehensive Income (after tax)]	2,340.15	2,229.86	1,773.51	7,835.01	6,938.63	7,935.28	2,493.30	1,720.85	13,239.29	7,244.30		
6	Equity share capital (Face Value of Rs. 5/- Per Share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00		
7	Other Equity				1,13,192.50	1,05,949.49				1,34,277.26	1,09,804.92		
	Earning per share of Rs. 5/- each (from Continuing and Discontinuing Operations)												
	Basic (in Rs.)	3.65	3.48	2.77	12.24	10.83	11.29	3.90	2.68	19.58	11.31		
	Diluted (in Rs.)	3.65	3.48	2.77	12.24	10.83	11.29	3.90	2.68	19.58	11.31		

Notes: (1) The above is an extract of the detailed format of quarter and year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the quarter and Year ended March 31, 2023 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (http://www.deepindustries.com).  
(2) The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on May 27, 2023. The statutory auditors of the company have carried out audit of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015  
(3) Figures of previous reporting periods have been regrouped/ reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.  
(4) The Board of Directors at its meeting held on 6<sup>th</sup> February 2023 approved the sub division of its Equity shares of face value Rs. 10 each into Equity shares of face value Rs. 5 each. The said sub division was further approved by the Share holders through Postal Ballot on 16<sup>th</sup> March 2023. The Company had fixed 10th April, 2023 as the record date for the purpose of sub-division of the Equity Shares. The Basic and Diluted EPS for the prior periods of standalone and the consolidated financial statements have been restated considering the face value of Rs. 5 each in accordance with Ind AS 33 - "Earning per Share".

For, DEEP INDUSTRIES LIMITED  
Sd/-  
Paras Savla  
Chairman & Managing Director  
(DIN: 00145639)

Place : Ahmedabad Date : 27.05.2023

**DECCAN CEMENTS LIMITED**  
CIN: L26942TG1979PLC002500  
Regd. Office: "Deccan Chambers", 6-3-666/B, Somajiguda, Hyderabad - 500 082  
Ph: 040-23310168, Fax: 040-23318366, Email: info@deccancements.com, Website: www.deccancements.com

**Extract of the Audited Financial Results for the Quarter and Year Ended 31 March 2023** (Rs. In Lakhs except per share data)

Sl. No.	Particulars	Quarter Ended						Year Ended					
		31.03.2023		31.12.2022		31.03.2022		31.03.2023		31.03.2022		31.03.2022	
		Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited
1	Total income from Operations	19594.06	21112.71	18618.90	78154.48	79184.38							
2	Net Profit for the period (before Tax and Exceptional items)	1337.69	1653.49	1855.91	6661.08	13590.93							
3	Net Profit for the period before tax (after Exceptional items)	1337.69	1653.49	(7.73)	6661.08	11727.29							
4	Net Profit for the period after tax (after Exceptional items)	989.51	1215.61	19.64	4929.53	8757.44							
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	950.77	1215.61	19.84	4890.79	8757.64							
6	Paid-up Equity Share Capital	700.38	700.38	700.38	700.38	700.38							
7	Earnings Per Share (Rs.5/- each)												
	1. Basic	7.06	8.68	0.14	35.19	62.52							
	2. Diluted	7.06	8.68	0.14	35.19	62.52							

Notes:  
a) The above results for the quarter and year ended were reviewed by the Audit Committee and approved by the Board of Directors at the meeting held on 27th May 2023.  
b) The above is an extract of the detailed format of financial results filed for the quarter and year ended 31 March 2023 with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid results are available on the Stock Exchange Websites i.e., Bombay Stock Exchange (www.bseindia.com) and National Stock Exchange (www.nseindia.com) and also on the Company's website (www.deccancements.com).

for DECCAN CEMENTS LIMITED  
Sd/-  
P Parvathi  
Managing Director  
Place : Hyderabad Date : 27.05.2023

**NOTICE FOR DUPLICATE SHARE CERTIFICATE**  
Notice is hereby given that below mentioned share certificates has / have been lost or mislaid and undersigned has / have applied to the Company to issue duplicate certificate(s) for the said shares.

Name of Company	Name of Shareholders	Folio No.	Certificate No.	Distinctive No.	No of shares
Aegis	Vinubhai A. Patel	V01029	9322	14899651 to 14902150	2500
Logistics Ltd	Vinubhai Ambalal Patel and Vmlabn Vinubhai Patel	V09016	9543	15287411 to 15288660	1250

Any person(s) who has / have the claim in respect of the aforesaid shares should lodge such claim with the Company at its Registered Office : 502, Skylon GIDC, 5th Floor, Char Rasta, Valsad, Vapi, Gujarat, 396195 within 15 days from this date else the Company will proceed to issue duplicate certificate(s).  
Place : Vadodara, Yours faithfully, Amrish Patel  
Date : 29th May, 2023

**MIRZA INTERNATIONAL LIMITED**  
CIN : L19129UP1979PLC004821  
Regd. Off. : 14/6, Civil Lines, Kanpur - 208001  
website : www.mirza.co.in ; e-mail : compliance@mirzaindia.com ; Tel. : +91 512 2530775

**EXTRACT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023** (Rs. in Lakh except earning per share data)

Sl. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended		Quarter ended		Quarter ended		Quarter ended		Quarter ended		Quarter ended	
		31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)	31.03.2022 (Audited)	
1	Total Income from Operations	15482.05	11820.72	15683.24	63208.40	140283.73	15791.70	13002.79	16521.37	65803.39	141641.10		
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	305.35	503.18	539.44	3410.75	11384.07	307.43	506.09	539.44	3596.00	11251.41		
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	305.35	503.18	539.44	3410.75	11384.07	307.43	506.09	539.44	3596.00	11251.41		
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	229.52	657.06	498.77	2618.30	8559.92	230.60	659.29	797.72	2644.90	8644.91		
5	Total Comprehensive Income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	229.52	657.06	498.77	2546.23	8748.13	285.60	721.59	882.63	2580.88	8801.46		
6	Equity Share Capital	2764.04	2406.12	2406.12	2764.04	2406.12	2764.04	2406.12	2406.12	2764.04	2406.12		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance sheet of the previous year	-	-	-	45521.33	43404.40	-	-	-	-	-		
8	Earning Per Share (of Rs. 2/- each) (For continuing & discontinued operations)												
	1. Basic:	0.17	0.55	0.41	1.89	7.11	0.17	0.55	0.66	1.91	7.19		
	2. Diluted:	0.17	0.55	0.41	1.89	7.11	0.17	0.55	0.66	1.91	7.19		

Notes:  
a) The above is an extract of the detailed format of the quarterly and year ended Standalone and Consolidated Financial Results filed with the Stock Exchange(s) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly and year ended Standalone and Consolidated Financial Results are available on the websites of BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively and on Company's website at www.mirza.co.in.  
b) The above Consolidated Financial Results of Mirza International Limited (The Company) and Subsidiaries (WOS) T N S Hotels and Resorts Private Limited and RTS Fashion Limited are drawn in terms of Regulation 33 of SEBI (LODR) Regulations, 2015.  
c) In terms of SEBI circular CIR/CFD/CMD/56/2016 dated May 27, 2016, the company hereby declares the auditors have issued audit report with unmodified opinion on annual audited financial results on year ended March 31, 2023.  
d) The Hon'ble National Company Law Tribunal, Allahabad Bench, Prayagraj vide its Order dated 21st February, 2023 (date of pronouncement or Order) approved the Composite Scheme of Arrangement or RTS Fashions Pvt Ltd, Mirza International Ltd and Redtape Ltd (the Scheme). The Scheme is effective from 1st January, 2022, being the Appointed Date of the Scheme. In terms of the Scheme, RTS Fashions Pvt Ltd has been merged into Mirza International Ltd along with all the assets and liabilities, and entire REDTAPE Business of Mirza International Limited has been demerged into Redtape Ltd, with effect from 1st January, 2022. The present Financial Results of the Company have been prepared after giving effect of the Amalgamation and Demerger in terms of the Scheme. Further, figures of the previous Financial Year ended 31st March, 2022, have also been restated to give effect to the Scheme with effect from 1st January, 2022.  
e) Figures for the period have been regrouped/rearranged whenever necessary in order to make them comparable.

For Mirza International Limited  
Sd/-  
(Tauseef Ahmad Mirza)  
Whole Time Director  
(DIN : 00049037)

Date : May 27, 2023  
Place : New Delhi

**ALEMBIC PHARMACEUTICALS LIMITED**  
CIN: L24230GJ2010PLC061123  
Regd. Office: Alembic Road, Vadodara - 390 003  
Tel.: +91 265-6637300  
Email: apl.investors@alembic.co.in  
Website: www.alembicpharmaceuticals.com

**NOTICE FOR CLAIMING SHARES FROM COMPANY'S UNCLAIMED SUSPENSE ACCOUNT**  
Notice is hereby given that the following Shareholders / Claimants of the Company have filed application(s) for claiming shares lying in Company's Unclaimed Suspense Account directly into their demat account:

Shareholder's and/or Claimant's Name	Folio No. (S)	Certificate No. (S
--------------------------------------	---------------	--------------------



